



“ नेशनल मिशन ओन ओइलसीड्स એન્ડ ઓઇલ પામ”
યોજના અંતર્ગત ફાર્મ ટેકનોલોજી ટ્રેનીંગ સેન્ટર, નેનપુર-
સણસોલી ખાતે ચાર દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો



કૃષિ મંત્રાલય, ભારત સરકાર હસ્તક યોજના “નેશનલ મિશન ઓન ઓઇલસીડ્સ એન્ડ ઓઇલ પામ (NMOOP), અંતર્ગત તા: ૨૫-૦૭-૨૦૧૭ થી ૨૮-૦૭-૨૦૧૭ દરમ્યાન ખેતીવાડી વિભાગ, મહેમદાવાદ તથા કૃષિ સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., સણસોલીના સંયુક્ત ઉપક્રમે નેનપુર કચેરી ખાતે ચાર દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો. જેમાં મહેમદાવાદ તાલુકાના અલગ અલગ ગામોમાંથી ૬૦ ખેડૂતો હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી અરવિંદભાઈ સોનારા (જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નડિયાદ), શ્રી ધવલભાઈ આર. પટેલ (મદદનીશ ખેતી નિયામક, નડિયાદ), ડૉ. એસ. ડી. રાહોડ (તાલુકા અમલીકરણ અધિકારીશ્રી, મહેમદાવાદ), ડૉ. બી. એન. પટેલ (કચેરીના વડા, કૃ.સં.કે., સણસોલી), ડૉ. જી. કે. પટેલ, (સહ સંશોધન વૈજ્ઞાનિક, કૃ.સં.કે., સણસોલી), પ્રો. એમ. બી. ઝાલા, (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, કૃ.સં.કે., સણસોલી), પ્રો. એસ. એ. સિપાઈ, (મદદનીશ વિસ્તરણ શિક્ષણશાસ્ત્રી, કૃ.સં.કે., સણસોલી) તથા મહેમદાવાદ તાલુકાના સર્વે ગ્રામ સેવકો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પધારેલ મહેમાનોને પુષ્પગુચ્છ અર્પીને કરાઈ હતી. ડૉ. બી. એન. પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રીએ આમંત્રિત મહેમાનો તથા પધારેલ ખેડૂતોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા કેન્દ્ર ખાતે ચાલતી સંશોધન, બીજ ઉત્પાદન અને વિસ્તરણની પ્રવૃત્તિઓથી ખેડૂતોને અવગત કર્યા હતા. જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, મદદનીશ ખેતી નિયામકશ્રી તથા મહેમદાવાદ તાલુકાના અમલીકરણ અધિકારીશ્રીએ ગુજરાત સરકારની કૃષિ સંલગ્ન વિવિધ યોજનાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરેલ. પ્રો. એમ. બી. ઝાલા, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિકે “દિવેલામાં પાક સંરક્ષણ” વિષય પર વિસ્તૃત વ્યાખ્યાન આપેલ. ડૉ. જી. કે. પટેલ, સહ સંશોધન વૈજ્ઞાનિકશ્રીએ તેલીબિયાઈ પાકોમાં પાક સુધારણા અને પાક સંવર્ધન વિષય પર વિસ્તૃત ચર્ચા કરેલ. પ્રો. એસ. એ. સિપાઈએ “કૃષિક્ષેત્રે પડતી મુશ્કેલીઓ તથા તેના નિવારણ માટેના જરૂરી પગલાં” વિશે વ્યાખ્યાન આપ્યું હતું. ડૉ. ટી. આર. પટેલ, રીસર્ચ એસોસિએટે પધારેલ ખેડૂતોને ક્ષેત્રીય મુલાકાત કરાવેલ.

કાર્યક્રમના અંતે શ્રી વલ્લભભાઈ પટેલ, વિસ્તરણ અધિકારી (મહેમદાવાદ) એ આભારવિધી કરી હતી.

કાર્યક્રમની ઝાંખી

